

26 ફેબ્રુઆરી 2019

## જીવન ગુણવત્તા અને અર્થતંત્રને પ્રોત્સાહિત કરવાનું બ્રેમ્પટનનાં 2019-2021નાં સૂચિત અંદાજપત્રનું લક્ષ્ય

બ્રેમ્પટન, ઓન્ટારિયો (26 ફેબ્રુઆરી 2019) – એક મુખ્ય શહેરના સર્જનનાં ભાગરૂપે પોતાની ભૂમિકાને વેગ આપતું બ્રેમ્પટનનું 2019-2021 સૂચિત અંદાજપત્ર આર્થિક વૃદ્ધિ માટે તકો ઊભી કરવા, વધુ ઉત્કૃષ્ટ પ્રોગ્રામ અને સેવાઓ પ્રદાન કરવા જે જીવન ગુણવત્તા સુધારવામાં ફાળો આપે અને એક સુશાસિત શહેરની અવિરત કાર્યક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સીટી ઓફ બ્રેમ્પટન દ્વારા તેમના 2019-2021 સૂચિત અંદાજપત્રને સાર્વજનિક સમીક્ષા અને ટિપ્પણીઓ માટે જારી કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત થનાર તમામ સૂચનો માર્ચ 18ના રોજ શરૂ થનારી અંદાજપત્રની ચર્ચાઓ દરમિયાન સીટી કાઉન્સિલની માર્ચ 27ના રોજની અંતિમ મંજૂરી બાદ ધ્યાન પર લેવાશે.

### 2019-2021 સૂચિત અંદાજપત્ર ના મુખ્ય મુદ્દાઓ

- આગામી ત્રણ વર્ષમાં બ્રેમ્પટન ટ્રાન્ઝિટ (Brampton Transit)ની ફ્લીટ 16 ટકાથી વધારવી, જેમાં 46 પ્રણાલીગત બસો અને 25 ઝૂમ (Züm) બસોનો ઉમેરો કરવા બાબત
- નોર્થવેસ્ટ બ્રેમ્પટન ખાતે નવું બંબાખાનું (ફાયર સ્ટેશન) બાંધવું, અગ્નિશમનના સાધનો અદ્યતન કરવા જેથી વધુ વિશ્વસનીય પ્રતિભાવ આપતા બળનું નિર્માણ થાય.
- ક્રિસ ગિબ્સન (Chris Gibson), હાવડન (Howden) અને બાલમોરલ રિક્રિએશન સેંટરોનો (Balmoral Recreation Centres) પુનરુદ્ધાર કરવો: ચિંગ્વુક્ઝી વેલનેસ સેંટરને (Chinguacousy Wellness Centre) અદ્યતન કરવું; રિવરસ્ટોન ગોલ્ફ ક્લબને (Riverstone Golf Club) 34,000 ચોરસ ફૂટના કમ્યુનિટી સેંટર તરીકે રૂપાંતરિત કરવું.
- બ્રેમ્પટનનો આર્થિક વિકાસ માસ્ટર પ્લાન માં ટકિલા આર્થિક ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા નવો માર્કેટિંગ એન્ડ ફોરિન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) પ્રોગ્રામ અને કમ્યુનિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામનું સર્જન કરવું.
- ઇનોવેશન અને કનેક્ટેડ લર્નિંગ માટેનાં સેન્ટરની સ્થાપના તરફ કામ કરવું.
- રિવરવોક પરિયોજના માટે પર્યાવરણીય આકારણી અને અર્બન ડિઝાઇન માસ્ટર પ્લાનનો અમલ કરવો.
- ટ્રાન્ઝિટની વૃદ્ધિ માટેની ભાવિ જરૂરિયાતો માટેના ભંડોળ માટે સમર્પિત, સ્થિર સ્ત્રોત પૂરો પાડવા માટે એક ટકો ટ્રાન્ઝિટ સમર્પિત વેરો (સરેરાશ વાર્ષિક ટેક્સ બિલ પર \$23 જેટલી રકમ) દાખલ કરવો.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર કર અને સૂચિત ટ્રાન્ઝિટ કરને ગણીને પણ અંદાજપત્રના ચોખ્ખા 0.8 ના સીટીનાં હિસ્સાનો વધારો લગભગ 20 વર્ષ સુધીમાં સૌથી ઓછો છે. કરદાતાઓ માટે તેમના વેરા બિલમાં સંયુક્ત મિલકત વેરાનો વધારો 2019માં 1.4 ટકા હશે. આમાં આ મુજબના વેરાના વધારાનો સમાવેશ થાય છે સીટી (0.3%), રિજન ઓફ પીલ (1.1%), અને સ્કૂલ બોર્ડ્સ (0%).

જાહેર પ્રતિસાદની તકો

- [ઓનલાઇન સંપર્ક ફોર્મ](mailto:2019Budget@brampton.ca) નો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછો અથવા ટિપ્પણી આપો અથવા તો [2019Budget@brampton.ca](mailto:2019Budget@brampton.ca) પર ઈમેલ કરો.
- તમારો પ્રશ્ન રજૂ કરવા 311 કોલ કરો.
- 4 માર્ચના રોજ સાંજે 6 થી 7 વાગ્યા સુધી ટાઉન હોલને ટેલિફોન કરોમાં ભાગ લો, જ્યાં સંભાવનાને આધારે થયેલ પસંદગીના ફોન નંબરો પર કોલ કરવામાં આવશે. કોલ સૂચિમાં તમારો નંબર ઉમેરવા માટે, [માર્ચ 3 સુધીમાં સીટી વેબસાઇટ પર સાઇન અપ કરો.](#)
- 18મી માર્ચ (સવારે 9:30 થી સાંજે 5 વાગ્યા સુધી) અને 20મી માર્ચ (બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી) સીટી હોલ ખાતે અંદાજપત્ર સમિતિની બેઠકોમાં હાજરી આપો. ઓવરડૂલો તારીખો છે માર્ચ 25 (સવારે 9:30 થી બપોરે 12) અને માર્ચ 26 (સવારે 9:30 થી સાંજે 5).
- માર્ચ 27ના રોજ (સાંજે 7-10) સ્પેશ્યલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપો જ્યારે સીટી કાઉન્સિલ અંદાજપત્ર મંજૂર કરવા જઈ રહી છે.
- અંદાજપત્રમાં હાજરી આપવા માટે [નિયુક્તિ વિનંતી](#) રજૂ કરો.

ક્વોટ

"બ્રમ્પટનની વૃદ્ધિ ઝડપથી થઈ રહી છે અને અમારી જવાબદારી એવું અંદાજપત્ર રજૂ કરવાની છે જે વૃદ્ધિની માંગો પર પર્યાપ્ત રીતે વિચાર કરે અને સાથે જ કરદાતાઓ માટે મૂલ્યમાં મહત્તમ વધારો કરે. સૂચિત અંદાજપત્રના ચોખ્ખા વધારામાં સીટીનો હિસ્સો લગભગ 20 વર્ષોમાં સૌથી ઓછો છે, તેમ છતાં તે સેવાઓ, પ્રોગ્રામ્સ અને સવલતોનો વિસ્તારિત સમૂહ રજૂ કરી શક્યા છે. અંદાજપત્રની ચર્ચાઓમાં જનતાના પ્રતિભાવ મહત્વપૂર્ણ છે અને અમે કાઉન્સિલને મદદરૂપ થવા માટે નિવાસીઓ, વેપારી પેઢીઓ અને સમાજના સમૂહોનું સ્વાગત કરીએ છીએ જ્યારે અમે અંદાજપત્રની ચર્ચાઓનો આરંભ માર્ચ 18ના રોજ કરીશું.

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**मिडिया संपर्क:**

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूटात्मक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)